

ધારણા. રૂઢું જવાબ પૂરા.

પ્ર.૨. ૧) ઓં એવું મિષ્ટાદવાચક પદ છે જેમનું જે સમગ્ર સ્વર્ણવેવાળા, પૂજાને યોગ્ય રાગ-ફેરને મુલનારા, યશવાળા અને દંદિયોને દમન કરનારા (મુનિરાજ) ના સ્વામી એવા શાંતિનાથ ને વારંવાર નમસ્કાર થાયો.

૨) જેના સારીરની કાંતિના સમૂહ સ્તિત્ત છે, જે નાગની ફૂલા ઉપર સેહેલા મહિના કિરણોથી વ્યાપ્ત છે, જે વીજળીની લગા સહિત મત્ત મેઘની જેમ ઓભે છે તે જી જિનેજ્જર પાર્વનાથ વાંકિલને આપી.

૩) એ વગેરે નિષ્કલંક કીલને ધારણા કરનારી મહાસતીએ જય પામે છે જે જેઓના યશનો પડદાએ પડા સમગ્ર ગણા ભુવનમાં વાગે છે.

૪) બ્રાહ્મ લેમજ અભ્યંતર લપમાં ઉદ્યોગેલ થયેલા તેવા, ગુણો રૂપી રત્નની મળા સમાન મુનિને પંદન કરું છું. દરોજ ઉઠીને કીર્તન કરું છું. જેના વડે ભુવવિશ્વ કહૈ ભવ-સાગરને તરું છું.

૫) પાણી, આમિ, ઝરે, સર્પ, ખરાબ-ગાદ, રક્ત, રોગ અને મૃત્યુના લક્ષી, શિક્ષા સંતુષ્ટોના, સજ્જ, મરકી, ધીર, સાલ દોલ અને જંગલી પ્રાણીઓના ભયથી.

૬) આચાર્ય, ઉપાધ્યાય, લેમના શિષ્ય, સ્વાધર્મિક, ફુલ અને ગણા ઉપર જે કોઈપણ મેં કષાય કર્યો હોય તે સર્વેને મન-વચન-કાર્યથી એવે ગિરિદે પ્રાપ્તું છું.

પ્ર.૫ ૭) આ સૂગવડે, આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સ્વાધુ, સમુદાય, સંદે અને સર્વ મુલોની સાથે પ્રાપ્ત થાય છે. મારે સૂત્ર બોલતી વખતે જરાબર ઉપયોગ રાખવામાં આવે તો કર્મનિર્જલા થાય.

૮) સંતિક્કસાય પ્રાવર્ણનાથ ભગવાન નું ચૈત્યવંદન છે. સ્વાધુ ભગવંતે અને સ્વાધુ ભગવંતે સંકારા પોરસી ભણાવતી વખતે બોલે છે. અને આવક, ખાસિકાઓ, દેવસિંચ પતિકમ્પાના અને સમાયિક પારતી વખતે બોલે છે.

૯) જી હજારની પટ્ટાણીઓ, પદાવતી, ગૌરી, ગાન્ધારી, લકુમણા, સુસીમા કૈભુવતી, સત્યભામા, કુકિમડગી એ છે. સ્થૂલભૂતની સાલ બહેનો છે, તે- ચક્રા, ચક્રાદત્તા, ભૂત્તા, ભૂતદત્તા, સેણા, વેણા, અને સેણા છે.



૪) સક્ષર લીધું નું બીજું નામ લીધું વંદના સૂચક છે જે ગુજરાતી ભાષા માં છે અને સચિતા બુવવિચયુ છે.

૫) ઉર્ધ્વલોક ના ચૈત્યો.

૧) દેવલોક ૩૨ લાખ

૨) દેવલોક ૨૮ લાખ

૩) દેવલોક ૧૨ લાખ

૪) દેવલોક ૮ લાખ

૫) દેવલોક ૪ લાખ

૬) દેવલોક ૫૦,૦૦૦

૭) દેવલોક ૪૦,૦૦૦

૮) દેવલોક ૩,૦૦૦

૯) દેવલોક ૪૦૦

૧૦) દેવલોક ૩૦૦

૧૧) દેવલોક ૩૦૦

૧૨) દેવલોક ૩૦૦

નવ ગૌવચકમાં ૩૧૮

અનુસારમાં ૫

૫- ૬) ઉત્તર- પેજ ને ૧૨૭

૭) ઉત્તર પેજ ને ૧૨૮

૮) અમૃત પ્રવચનમાલા

૯) એપડા સમિતિ

૧૦) દીર્ઘાસમિતિ

૧૧) ભાષા સમિતિ

૧૨) આદ્ય-ભા. નિષ્કર્ષેષા સમિતિ

૧૩) પારિષદા-પનિકા સમિતિ

૧૪) મનોગુપ્તિ

૧૫) વચનગુપ્તિ

૬) પોષધના મુખ્ય આર જોઈ છે. ૧) આદ્ય પોષધ - ઉપવાસ વગેરે તપ કરવા લે ૨) શરીર સ્વચ્છ પોષધ - શરીરની સ્માન વિશેષનાદિ વડે વિભૂષા - સ્વચ્છ ન કરવા લે. ૩) બ્રહ્મચર્ય પોષધ - શિયળ પાળવું લે ૪) - અવ્યાપાર પોષધ - સાવધાન વ્યાપાર કરવું લે.

૭) પૌષ્ઠ્ય એકાદશી આર પૂર નો અંગે આપ્યા દિવસ - શાન મળી આસ પૂર નો કરાય.